

17th June, 2022

Ref. No.: AIL/SE/07/2022-23

To,

**BSE Limited** 

Phiroze Jeejeebhoy Towers, Dalal Street, Fort, Mumbai-400001, MH.

Scrip Code: **543534** 

**National Stock Exchange of India Limited** 

Exchange Plaza, Bandra Kurla Complex, Bandra (E), Mumbai-400051, MH.

Symbol: **AETHER** 

Dear Madam / Sir,

Sub.: Newspaper advertisement for Financial Results for the Fourth Quarter and Financial Year ended on 31.03.2022

In accordance with Regulation 30 and Regulation 47 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015, the newspaper advertisement published in 'Gujarat Mitra' and 'Financial Express' for the Standalone Audited Financial Results for the Fourth Quarter and Financial Year ended on 31.03.2022 is enclosed herewith.

We request you to kindly take the information on your records.

Thank you.

For Aether Industries Limited

Chitrarth Rajan Parghi

Company Secretary & Compliance Officer

Encl.: As above





કોંગ્રેસી નેતા રેણુકા ચૌધરીએ પોલીસવાળાનો કોલર પકડી લીધો, ગુનો દાખલ હૈદરાબાદ, તા. 16: નેશનલ હેરાલ્ડ થયો હતો અને આ વીડિયો સોશિયલ

મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની સતત ત્રણ દિવસ પૂછપરછ કરી હતી. ઇડીની આ તપાસના વિરોધમાં કોંગ્રેસ પાર્ટી સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શનો કરી રહી છે. વિરોધ પ્રદર્શનોના આ સિલસિલામાં ગુરુવારે હૈદરાબાદમાં કોંગ્રેસ પાર્ટીના 'ચલો, રાજભવન' અભિયાન અંતર્ગત પ્રદર્શન કરવામાં આવ્યું હતું. દરમિયાન ત્યાં હાજર પોલીસ દળોએ પ્રદર્શનમાં સામેલ કોંગ્રેસની વરિષ્ઠ નેતાની અટકાયત કરવાનો પ્રયાસ કરતાં રેશુકા ચૌધરીએ એક પોલીસ કર્મચારીનો કોલર પકડી લીધો હતો. એટલું જ નહીં, પોલીસવાળાને ધમકાવી પણ રહી હતી. આ સમગ્ર ઘટનાક્રમ એક વીડિયોમાં કેદ

મીડિયામાં વાયરલ પણ થઈ ગયો હતો. જેના કારણે રેણુકા ચૌધરીએ સ્પષ્ટતા પણ કરવી પડી હતી. તા. 16 જૂન ને ગુરુવારે હૈદરાબાદમાં કોંગ્રેસ પાર્ટીનું ચલો રાજભવન અભિયાન અંતર્ગત પ્રદર્શન દરમિયાન કોંગ્રેસી નેતા રેણુકા ચૌધરીનો જે વીડિયો વાયરલ થયો છે તે લગભગ 43 સેકન્ડનો છે. પોલીસ કર્મીનો કોલર પકડવા મામલે સબ-ઇન્સ્પેક્ટરની ફરિયાદના આધારે આઈપીસીની કલમ 353 મુજબ રેશુકા ચૌધરી સામે ગુનો દાખલ કરાયો છે. આ કલમ સરકારી કર્મચારીને તેના કામમાં અવરોધ ઊભો કરવા બદલ અને હુમલો કરવા પર લગાવવામાં

### જીએસટી કાઉન્સિલની મીટિંગ 28-29 જુને શ્રીનગરમાં છે. કારણ કે. તેમાં દર તર્કસંગતતા પર

**વુમાં** દક વર્ફસંગવવા**ૂ** પર રાજ્ય મંત્રીઓની પેનલના અહેવાલ અને डेसिनो, रेस डोर्स अने ઓનલાઇન ગેમિંગ પરના ટેક્સના દરની ચર્ચા થવાની અપેક્ષા

નવી દિલ્હી, તા. 16 (પીટીઆઈ): નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ની મીટિંગ 28-29 જૂને શ્રીનગર ખાતે મળશે. નાણામંત્રી કાર્યાલયે ટ્વિટ કર્યું હતું કે, ''જીએસટી કાઉન્સિલની 47મી મીટિંગ 28-29 જૂન 2022 દરમિયાન શ્રીનગરમાં યોજાશે." આ બીજી વખત છે જ્યારે જીએસટી કાઉન્સિલની બેઠક શ્રીનગરમાં યોજાઈ રહી છે. 1 જુલાઈ, 2017ના રોજ જીએસટીની શરૂઆત પહેલાં શહેરમાં 18 અને 19 મેના રોજ કાઉન્સિલની 14મી બેઠક યોજાઈ હતી. બે દિવસની બેઠકમાં 1,211 વસ્તુઓ પરના જીએસટી દરને મંજૂરી આપવામાં આવી હતી. 47મી જીએસટી સમિતિની બેઠક મહત્ત્વપૂર્શ

અને કેસિનો, રેસ કોર્સ અને ઑનલાઇન ગેમિંગ પરના ટેક્સના દરની ચર્ચા થવાની અપેક્ષા છે. કેન્દ્રીય નાણામંત્રીની અધ્યક્ષતામાં અને રાજ્યના સમકક્ષોની આગેવાનીમાં મળનારી જીએસટી કાઉન્સિલની મીટિંગમાં પ્રક્રિયાઓમાં ચોક્કસ સરળીકરણો અંગે પણ ચર્ચા થાય તેવી અપેક્ષા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, કાઉન્સિલની બેઠક પહેલા જીએસટી દરના તર્કસંગતીકરણ પર રાજ્ય મંત્રીઓની પેનલ 17 જૂને ટેક્સના દરોમાં સંભવિત ફેરફાર અંગે ચર્ચા કરવા માટે મળવાની છે. મંત્રીઓના જૂથ (જીઓએમ) ટેક્સ સ્લેબમાં સંભવિત ફેરફારો અંગે ચર્ચા કરે તેવી શક્યતા છે, સૂત્રોએ જણાવ્યું હતું કે પેનલના અંતિમ અહેવાલમાં થોડો વધુ સમય લાગશે. આ ઉપરાંત કાઉન્સિલ નકલી ઈનપુટ ટેક્સ ક્રેડિટ દાવાઓને ચકાસવા અને વાસ્તવિક પતાવટને ઝડપી બનાવવા માટે સારાંશ રિટર્ન અને માસિક ટેક્સ ચુકવણી ફોર્મ જીએસટીઆર-3Bમાં કેટલાક ફેરફારો પર પણ વિચાર કરી

રાજ્ય મંત્રીઓની પેનલના અહેવાલ

### મહારાષ્ટ્રમાં એટીએમમાંથી 5 ગણા રૂપિયા નીકળતા લોકો ઊમટી પડ્યા

એક વ્યક્તિએ ઓટોમેટેડ ટેલર મશીન (એટીએમ)માંથી રૂ. 500 ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે એક સુખદ આશ્ચર્ય સાથે મહારાષ્ટ્રના નાગપર જિલ્લામાં એટીએમમાંથી રૂ. 500ની 5 ચલણી નોટો નીકળી! રૂપિયા ઉપાડવા આવનારે ફરી વાર 500 રૂપિયા ઉપાડવાનો પ્રયાસ કરતાં ફરીથી 2,500 રૂપિયા મળ્યા હતા. આ ઘટના બુધવારે નાગપુર શહેરથી 30 કિમી દૂર આવેલા ખાપરખેડા શહેરમાં અધિકારીએ જણાવ્યં હતં.

નાગપુર, તા. 16 (પીટીઆઈ)ઃ એક ખાનગી બેંક (એટીએમ)માં બની હતી. આ સમાચાર જંગલની આગની જેમ ફેલાઈ જતાં થોડી જ વારમાં એટીએમ સેન્ટરની બહાર રોકડ ઉપાડવા માટે લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં. પાછળથી બેંકના ગ્રાહકે સ્થાનિક પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને એટીએમ સેન્ટર બંધ કરી દીધું હતું અને બેંકને જાણ કરી હતી. એમ ખાપરખેડા પોલીસ સ્ટેશનના એક

મોજે સાતેમના બ્લોક નં.૪૫૪, ૪૮૨/બ, ૪૫૫ અંગે એડવોકેટ અજય આર. ગાંધી મારફતે તા.૧૫/૦૬/૨૦૨૨ ના રોજ સોદો રદ કર્યા અંગેની જાહેર નોટીસ આપેલ હતી જેનો જાહેર જવાબ તથા જાહેર ચેતવણી

नवसारी डिस्टीइट ता.नवसारी सज डिस्टीइट नवसारीना मोषे गाम सातम ना **ज्योड नं.४५४** वार्ण જુની શરતની ખેતીની જમીન જેનું ક્ષેત્રફળ હે.આરે. 3-3૨-૮૫ ચો.મી. જેનો આકાર રા.૪૯.૬૮ પૈસા છે નથા ખાતા નંબર ૧૦૨૫ ચાલી આવેલ છે તે જમીન તથા **બ્લોક નં.૪૮૨/બ** વાળી જુની શરતની ખેતીની જમીન જેનું ક્ષેત્રફળ હે.આરે. ૦-७૪-૮७ ચો.મી. જેનો આકાર રૂા.૧૫.૧७ પૈસા છે તથા ખાતા નંબર ૧૦૨૪ ચાલી આવેલ છે તે જમીન તથા **બ્લોક નં.૪૫૫** વાળી જુની શરતની ખેતીની જમીન જેનું ક્ષેત્રફળ હે.આરે ૦-૨૩-૨७ ચો.મી. જેનો આકાર રા.૨.૨૫ પૈસા છે તથા ખાતા નંબર ૧૦૨૩ ચાલી આવેલ છે તે જમીન અમોના અસીલ ખરીદનાર **સમીરભાઇ મુલતાની,** સુરતનાએ **તા.૧૩/૦૫/૨૦૨૨** ના રોજ ખેડુત પાસેથી વેચાણથી રાખેલ છે. તેમજ નકકી થયેલ વેચાણ અવેજ મુજબ પાર્ટ પેમેન્ટ કરી વેચાણ સોદા અંગેના લખાણો કરવામાં આવેલ. જેમાં **ગીતાબેન પરભુભાઈ પટેલ**નાઓએ અંગુઠાનું છાપનું નિશાન અને પોતાર્ન સહીઓ કરેલ અને અમોના અસીલને જમીન વેચાણથી આપેલ . તે અંગે સાક્ષીમાં તેઓના **પડોશી કૌટુંબિક** भित्र **येतनलाई ठाङोरलाई पटेब**नाએ सही इरेब हती. तेमक **ता.१५/०६/२०२२** ना रोक वेयाए અંગેની પેપર નોટીસ પણ કરેલ. તેમજ પેપર નોટીસની મુદત પ્રત્યા બાદ ખેડુતને વેચાણ અવેજના બાકીન રૂપિયામાંથી ૨૫% વેચાણ અવેજ ચુકવી આપી વેચાણ દસ્તાવેજ ખેડુતે કરી આપવાનું બાંહેધરી આપેલ અને બાકીના રૂપિયા ૧૨ માસની મુદ્દત પ્રમાણે ખરીદનારે ટુકડે ટુકડે ખેડુતને ચુકવી આપવાના રહેશે તેવી રીતે સોદો નકકી કરવામાં આવેલ તેમજ ઉપરોક્ત જણાવ્યા મુજબ શરતોમાંથી ૨૫% રૂપિયા લઈ ખેડુત વેચાણ દસ્તાવેજ કરી આપતા નથી. જેથી અમોના અસીલ **સમીરભાઈ મલતાની**ના લાખો રૂપિયા લઈને સોદામાંથી ફરી જવાની બદનાદત રાખી સોદો કેન્સલ કરવા માટે ઉદાવ પેપર નોટીસ કરવામાં આવેલ હતી. જેથી આજરોજ જાહેર ચેતવણીવાળી નોટીસ આપીને અમોના અસીલ સખત વાંધો હોય જેથી જાહેર જનતાને જણાવવાનું કે; સદરહુ જમીન અંગેના કાયદેસરના **ગીતાબેન પરભુભાઈ પટેલ**નાઓએ સોદો કરી અમોના અસીલને તમામ લખાણે કરી આપેલ છે. જેથી ફકત **ગીતાબેન પરભુભાઈ પટેલ**નાઓએ બદદાનત રાખી અન્ય પાર્ટીને જમીન ઉંચા ભાવે વેચવાની લાલચ રાખીને સોદો કેન્સલ કરવાની કોશિષ કરી ઉદાવ પેપર નોટીસ **એડવોકેટ અજય આર. ગાંધી** મારફતે આપવામાં આવેલ હતી. જેથી તેવી ખોટી કાયદા વગરની પેપર નોટીસ કરી સોદો રદ થતો નથી, સોદો રદ કરવા માટે સોદા રદ કરવા અંગેનું લખાણ બનાવવું પડતું હોય છે જેમાં બંને પક્ષકારોની સહી સંમતિની જરૂરીયાત હોય છે જેવું કેન્સલેશન કોઈપણ લખાણમાં અમોના અસીલે કરેલ નથી કે સહી મત્તા કરેલ નથી કે તેવી કોઈ સંમતિ આપેલ નથી જેથી આજરોજ આ જાહેર ચેતવણી આપી જણાવવાનું કે; આ જમીન ખરીદ કરવા અંગેના સોદા મુજળ તથા કરેલા લખાણો મુજબ અમોના અસીલનો હકક કાયમ ચાલી આવેલ છે અને રહેશે. જેથી **ગીતાબેન પરભુભાઈ પટેલ**નાઓ સાથે કોઈપણ જાતની કોઈપણ વ્યક્તિ, ઈસમ, સંસ્થાએ સોદો કરવો નહીં તથ નાણાંકીય વ્યવહાર કરવાનો રહેશે નહીં અને જો તેમ ઉપરોક્ત જમીનમાં કોઈપણ વ્યવહારો કરવામ आवशे तो तेवा व्यवहारो डायदेसर मान्य गशाशे नहीं. षेथी षमीनना टाईटल तेवा व्यडितने है સંસ્થાને મળશે નહીં અને જો તેમ કરવામાં આવશે તો તેઓને તેઓ વિરૂધ્ધ કાયદેસર તથા ખેડૂત વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી સીવીલ કોર્ટમાં દિવાની રાહે પોતાનો હકક મેળવવા માટેનો દાવો અમોના અસીલ કરશે. જેની જાહેર જનતાએ ગંભીર નોંધ લેવી

ता. १७/०६/२०२२ સુરત. A multani

હમારા અસીલની સુચનાથી GAYATRI O. PANDIT (Advocate) A-44, Gunatit Nagar, Nr. Rupali Naher . Bhatar Road, Surat. Mo. No. 90543 25067



» ડલાસ, તા. ૧૬: અમેરિકાના દક્ષિણી મોન્ટાના અને ઉત્તરીય વ્યોમિંગમાં દિવસો સુધી પડેલા વરસાદ અને બરફના ઝડપથી પીગળવાના કારણે નદીઓમાં ભારે પૂર આવ્યા છે અને આજુબાજુના વિસ્તારોને વ્યાપક અસર થઇ છે. યલોસ્ટોન નદીમાં ભારે પૂર આવવાને કારણે તેની નજીકના નગરો, માર્ગી અને પુલોને નુકસાન થયું છે, કેબિનો ખેંચાઇ ગઇ છે અને વિજળી પુરવઠો ખોરવાઇ ગયો છે. આ વિસ્તારમાં આવેલા અભૂતપૂર્વ પૂરને કારણે ચલોસ્ટોન નેશનલ પાર્ક અચોક્ક્સ મુદ્દત સુધી બંધ કરી દેવો પડ્યો છે અને આ પાર્ક એવા સમયે બંધ કરવો પડ્યો છે જ્યારે ઉનાળાની રુજાઓમાં અહીં મોટા પ્રમાણમાં પર્યટકો આવી શકે છે. પાર્કના અધિકારીઓએ આ પ્રદેશમાં આવેલા પૂરને હબાર વર્ષમાં એકાદવાર આવે તેવું પૂર ગણાવ્યું હતું.

### ફેડરલ રિઝર્વના આક્રમક દર વધારાથી અમેરિકામાં મંદી સર્જાવાની શક્યતા

**આર્થિક** નિષ્ણાતોના કહેવા પ્રમાણે આક્રમક દર વધારાને કારણે ધિરાણ ખૂબ મોંધુ બનશે અને તેથી ખર્ચ શક્તિ ઘટશે, રોજગારીમાં વૃદ્ધિ દ્યીમી પડશે અને છેવર્ટ અર્થતંત્રમાં મંદી આવશે

વૉશિંગ્ટન, તા. ૧૬(પીટીઆઇ)ઃ અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષના અધ્યક્ષ જેરોમ પોવેલ એ પ્રતિજ્ઞા કરી છે કે તેઓ ફુગાવાને નાથવા માટે જે થઇ શકે તે કરશે જે ફુગાવો ચાર દાયકાના ઉંચા સ્તરે પ્રવર્તી રહ્યો છે અને તેને નાથવાના ફેડના પ્રયાસોને અત્યાર સુધી તેણે ગણકાર્યા નથી.

વધતા જતા ફુગવાને નાથવા ફેડરલ રિઝર્વે તેના દરો તો વધાર્યા છે પણ તેણે એક દુઃખદ બાબત ટાળવાની જરૂર જણાય છે અને તે છે મંદી. મેમાં અપેક્ષા કરતા વધુ ખરાબ ફુગાવો નોધાયો જેમાં કન્ઝ્યુમર ભાવો એક વર્ષ અગાઉની સરખામણીમાં ૮.૬ ટકાની રોકેટ ગતિએ ઉછળ્યા જે ૧૯૮૧ પછીનો સૌથી મોટો ઉછાળો છે તેને કારણે ફેડરલ રિઝર્વે બુધવારે પોણા પોઇન્ટ જેટલા બેન્ચમાર્ક વ્યાજ દરો વધાર્યા. જો કે ૧૯૯૪ પછી અમેરિકાની મધ્યસ્થ બેંકે ક્યારેય વ્યાજ દરો આટલા વધાર્યા નથી. જો કે નિષ્ણાતો માને છે કે અર્થતંત્રને પાટા પરથી ઉતાર્યા વિના ફુગાવાને તેના ૨ ટકાના લક્ષ્યની

અંદર લાવવા માટેની પોવેલની કવાયત જોખમી પણ છે. દરેક દર વધારાનો અર્થ થાય છે કે ગ્રાહકો અને ધંધાઓ માટે ધિરાણ લેવાની કિંમતો વધશે અને દર વખતે ધિરાણ લેનારાઓ માટે ધિરાણ મોંઘુ બનતું જશે અને આના કારણે ખર્ચ શક્તિ ઘટશે, તેના કારણે વિશ્વાસ નબળો પડશે, રોજગારીમાં વૃદ્ધિ ઘટશે અને કુલ આર્થિક ઉત્સાહ મંદ પડશે. સ્ટેટ સ્ટ્રીટ ગ્લોબલ એડવાઇઝર્સના મુખ્ય અર્થશાસ્ત્રી સિમોના મોકુતાએ જણાવ્યું હતું કે આ દર વધારાની કિંમત ચુકવવી પડી શકે છે. તેમના કહેવા પ્રમાણે મંદીનું જોખમ હવે ૫૦-૫૦ છે. અન્ય એક અર્થશાસ્ત્રી રોબર્ટ ટિપે પણ જણાવ્યું હતું કે મંદીનું જોખમ વધી

### પાકિસ્તાનની સરકા

હવેથી નવા ભાવ મુજબ પ્રતિ લીટર પેટ્રોલ રૂં. 233.89, Sੀਡਰ-263.31 **ਅ**ਰੇ કੇ**રો**સੀਰ 3.211.47 ਪ੍ਰਹਿ લੀટਵ

ઇસ્લામાબાદ, તા. 16 (પીટીઆઈ): પાકિસ્તાનની સરકારે રાજકોષીય ખાધને ઓછી કરવાના પ્રયાસમાં ઇંધણની સબસિડી દૂર કરીને અને રોકડની તંગીવાળા અર્થતંત્ર માટે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ) તરફથી

ભાવમાં 29 ટકા સુધીનો વધારો ઝીંક્યો છે. વડા પ્રધાન શેહબાઝ શરીફની આગેવાની હેઠળની સરકાર દ્વારા માત્ર 20 જ દિવસમાં ઇંધણ સબસિડીમાં આ ત્રીજો ઘટાડો છે. નાણામંત્રી મિક્તાહ ઇસ્માઇલે જણાવ્યું હતું કે, નવી કિંમતો બુધવારની મધ્ય રાત્રિથી અમલમાં આવી હતી અને પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર રૂ. 24 અને હાઇ-સ્પીડ ડીઝલ (એચએસડી)ના લીટરદીઠ રૂ. 59.16નો જંગી વધારો કરાયો હતો. જે બે ઉત્પાદનો દરેક વ્યક્તિ દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે

મહત્ત્વપૂર્ણ સમર્થન મેળવવા ઇંધણના ઉપયોગમાં લેવાય છે.'' તાજેતરનો વધારો 25 મેથી પેટ્રોલિયમના ભાવમાં પહેલાથી જ રૂ. 60ના વધારાની ટોચ પર આવ્યો છે. નવા ભાવવધારા સાથે હવે પેટ્રોલની નવી કિંમત પ્રતિ લીટર રૂ. 233.89 અને એચએસડી પ્રતિ લીટર રૂ. 263.31 તેમ જ કેરોસીનની કિંમત પ્રતિ લીટર રૂ. 211.47 નક્કી કરવામાં આવી છે. વડા પ્રધાન શરીફ્રે ગુરુવારે આ અપ્રિય પગલાનો બચાવ કરતાં કહ્યું હતું કે, આઈએમએફ સાથે જેમણે અત્યાર સુધીનો સૌથી ખરાબ સોદો કર્યો હતો. તેને કારણે સરકાર પાસે કોઈ વિકલ્પ બચ્યો નથી.''

# પાક. વડાપ્રધાન શાહબાઝ અને ભૂતપુર્વ વડાપ્રધાન ઇમરાનખાન કરતા તેમની પત્નીઓ વધે ધનવાન છે

શાહભાઝ શરીફના પત્ની નુસરત શાહબાઝ પાસે રૂ. २३०. २६ भितियननी भिट्डती છે, જ્યારે શાહબાઝ પાસે રૂ. ૧૦૪.૨૧ મિલિચનની મિલકતો છે, જો કે શાહબાઝના બીજા પત્ની તેહમીના દુર્રાની પાસે રૂ. ૫.७६ મિલિયનની જ મિલકતો છે

**ઇમરાન** ખાન પાસે ખેતી અને બિનખેતીની જમીનો, રૂ. દ્ કરોડની બેંક થાપણો વગેરે મિલકતો છે જ્યારે તેમના પત્ની બુશરા બીબી પાસે રૂ. ૧૪૨.૧૧ भिલियननी भिલ્કતો છે

ઇસ્લામાબાદ. તા. ૧૬(પીટીઆઇ)ઃ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની પત્નીઓની નાશાકીય મિલકતો તેમના પતિઓ કરતા વધારે છે એ મજબ આજે મીડિયા અહેવાલે જણાવ્યું હતું.

૩૦ જૂન, ૨૦૨૦ના રોજ પુરા થતા જવાબદારીઓ છે. નાણાકીય વર્ષ માટે પાકિસ્તાનના ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરવામાં આવેલા મિલકતોના નિવેદનમાં નુસરત શાહબાઝ, કે જેઓ વડાપ્રધાન શાહબાઝ શરીફના પ્રથમ પત્ની છે તેમણે આપેલી વિગતો મુજબ તેઓ તેમના પતિ કરતા વધુ ધનવાન છે અને રૂ. ૨૩૦.૨૯ મિલિયનની મિલકતો ધરાવે છે. વડાપ્રધાનના આ પત્ની લાહોર અને હઝારા ડિવિઝનોમાં

નવ ખેતીની મિલકતો અને એક ઘર પણ ધરાવે છે. આ મિલકતો ઉપરાંત શાહબાઝ શરીફના પત્ની અનેક સેકટરોમાં નોંધપાત્ર રોકાશ પશ ધરાવે છે. વડાપ્રધાન પાસે જો કે રૂ. ૧૦૪.૨૧ મિલિયનની જ મિલકતો છે અને રૂ. ૧૪૧.૭૮ મિલિયનની





विना भुट्ये બીપીએલ, મા–અમૃતમ્, આચુષ્માન ભારત, ઈ-શ્રમ લાભ મળશે કાર્ડ ઘરાવતા દર્દીઓને

**४न२स, हांत, डान, ना**ङ, ગળાની, હાડકાંની તથા આંખની સર્જરી

કાર્ડ વગરના દર્દીઓ 🚅 ફક્ત માટે સર્જરી ચાર્જ

રજીસ્ટ્રેશન તથા ફ્રી બસ સુવિદા માટે भो. ८६८००२९०२५




### બાલસંગમ હોસ્પિટલ

સુજન મેગા પાવર પ્લાન્ટ પાસે ગાચ પગલા મંદિર સામે, તાં. કામરેજ, જી. સુરત. । ફો.: ૦૨૬૨૧–૨૬७૦૦૧/૨૬७૦૦૨




#### ફિલ્મ-નિર્માતા બી.આર. ચોપડાનો બંગલો 183 કરોડમાં વેચાયો

મુંબઈ, તા. 16: બોલિવૂડના પ્રખ્યાત ડિરેક્ટર અને પ્રોડ્યુસર બલદેવ રાજ ચોપડા જેઓ બી. આર. ચોપડાના નામથી જાણીતા છે. 1988માં પ્રસારિત થયેલી 'મહાભારત' સીરિયલથી ઘરે-ઘરે લોકપ્રિય બનેલા બી.આર. ચોપડાનો બંગલો તાજેતરમાં 183 કરોડ રૂપિયામાં વેચાયો છે. પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આ બંગલો એક ફેમસ રિચલ એસ્ટેટ ડેવલપર કે. રહેજા કોર્પ.એ ખરીદ્યો છે. બી. આર. હાઉસ મુંબઈના જુહુ વિસ્તારમાં 25,000 સ્ક્વેર ફૂટમાં લગભગ એક એકર જમીનમાં ફેલાચેલો છે. જાણવા મળ્યા મુજબ,



બી. આર. હાઉસની ડીલ ગયા મહિને થઈ હતી. તેમ જ ડેવલપરે આ ઘરના રજિસ્ટ્રેશન માટે લગભગ 11 કરોડ રૂપિયાની સ્ટેમ્પ-ડ્યૂટી પણ ભરી દીધી છે.



				(Rupees	in million exc	ept as stat
S.	Particulars		Quarter Ende		Year e	
lo.		31.03.2022	31.12.2021	31.03.2021	31.03.2022	31.03.202
		(Audited)	(Audited)	(Audited)	(Audited)	(Audited
				(Refer Note 7)		
	Income		100021220200	greg to contain	100 May	VI VIII VIII VIII VIII VIII VIII VIII
1	Revenue From Operations	1,475.04	1,512.77	1,157.26	5,900.47	4,498.16
2	Other Income	2.03	23.84	7.23	69.74	39.73
3	Total Income (1+2)	1,477.06	1,536.61	1,164.48	5,970.21	4,537.89
	Expenses	25.5	4.400	200	0.000	2/2/2
	a) Cost of material consumed	839.21	1,122.15	511.01	3,585.21	2,249.16
	b) Changes in inventories	(107.64)	(364.53)	19.51	(704.88)	57.72
	c) Employee benefits expenses	57.58	70.46	60.38	270.44	221.13
	d) Finance Cost	30.86	36.43	33.46	131.21	113.15
	e) Depreciation and amortisation expenses	40.68	41.78	26.44	154.87	110.1
J	f) Other Expenses	264.76	292.50	210.18	1,068.63	848.56
	Total Expenses	1,125.45	1,198.79	860.99	4,505.48	3,599.83
,	Profit before exception items and tax (3-4)	351.62	337.81	303.49	1,464.73	938.0
3	Exceptional items				-	
	Profit before tax (5-6)	351.62	337.81	303.49	1,464.73	938.0
	Tax Expenses	100,000	2022220	<u> </u>	12,000,000	(Agents areas
	Current Tax	80.61	105.50	71.78	338.73	201.00
	Deferred Tax	10.78	(21.68)	3.07	36.72	25.87
3	Total tax expenses	91.39	83.81	74.84	375.44	226.8
	Profit for the period/year (7-8)	260.23	254.00	228.65	1,089.29	711.19
	Other comprehensive income/(expenses)					
	Items that will not be reclassified to profit or loss	(80.0)	0.75	0.92	(1.98)	(0.86
	Income tax relating to items that will not be reclassified to profit or loss	0.02	(0.19)	(0.23)	0.50	0.22
)	Other comprehensive income/(expenses) for the period/year, net of tax	(0.06)	0.56	0.69	(1.48)	(0.64
1	Total comprehensive income for the period/year (9+10)	260.17	254.56	229.34	1,087.81	710.5
2	Profit for the period/year attributable to:					
	-Owners of the Company	260.23	254.00	228.65	1,089.29	711.19
	-Non controlling interest					42.2
	2000 10 10 100 100	260.23	254.00	228.65	1,089.29	711.19
3	Other comprhensive income/(expenses)					
	for the period/year attributable to:	/A AA*	(A) ##	0.00	241401	100
	-Owners of the Company	(0.06)	0.56	0.69	(1.48)	(0.64
	-Non controlling interest	10.000	0.00		74	22020
J		(0.06)	0.56	0.69	(1.48)	(0.64
	Total comprehensive income for the					
	period/year attributable to:	000.47	054.55	000.01	4 007 00	9100
	-Owners of the Company	260.17	254.56	229.34	1,087.81	710.5
	-Non controlling interest			-	4 ***	2270
J		260.17	254.56	229.34	1,087.81	710.5
	(Face value of Rs.10/- each)			No. of Contract of		
	-Basic	2.31	2.29	2.37	9.67	7.36
	-Diluted	2.31	2.29	2.37	9.67	7.30
	Paid-up equity share capital	1,126.91	1,126.91	100.99	1,126.91	100.99
	(face value of Rs.10/- each)	2 7/14 07	2 475 05	1 642 24	2 744 07	1 640 0
7	Other equity excluding revaluation reserve	2,741.97	2,475.85	1,642.34	2,741.97	1,642.34
1	No. of Shares (in millions)	113	111	97	113	97

1. The above audited standalone financial results have been reviewed by the Audit Committee and thereafter approved and taken on record by the Board of Directors in their respective meetings held on June 16, 2022. These audited standalone financials results of the Company are prepared in accordance with Indian Accounting Standards ("referred to as Ind AS") as prescribed under Section 133 of the Companies Act, 2013 read with Companies (Indian Accounting Standards) Rules, 2015 as amended from time to time and the provisions of the Companies Act, 2013.

The Statutory Auditors of the Company have audited the above standalone financial results of the Company for the quarter and year ended March 31, 2022. An unqualified opinion has been issued by them thereon.

3. The standalone results of the Company are available on the Company's website, www.aether.co.in and also on the website of the BSE Limited, www.bseindia.com and National Stock Exchange of India Limited, www.nseindia.com, where the shares of the

4. Details included in Other income (net) areas below

Particulars	8	Quarter Ended	Year ended		
	31.03.2022 (Audited)	31.12.2021 (Audited)	31.03.2021 (Audited)	31.03.2022 (Audited)	31.03.2021 (Audited)
Interest					
Interest on fixed deposits	2.49	1.68	0.67	4.64	1.00
Interest accrued on loans to employees	0.40	0.31	0.25	1.29	0.85
Interest on deposits	0.01	0.01	0.00	0.03	0.03
Others	8.335940	0.000	and Refer	105550	his delta
Foreign exchange fluctuation	(3.13)	8.73	3.75	18.37	18.32
Duty drawback - exports	1.56	1.46	0.84	5.14	2.92
MEIS duty credit	0.10	0.36	0.85	21.65	15.42
Income from mutual funds	0.51	1.19		3.22	
Income accrued from mutual funds	0.00	0.00	0.78	0.00	0.79
Profit on sale of assets	14	~	0.00	*	0.02
Interest subsidy (term loan)	12	10.00		15.00	
Misc. income	0.09	0.10	0.09	0.38	0.38
Total	2.03	23.84	7.23	69.74	39.73

5. The Company was incorporated on January 23, 2013 and in May 2022, the Shareholders of the Company made an offer sale of 2,820,000 equity shares to INR 1,810.44 million. The equity shares of the Company got listed on BSE Limited (BSE) and National Stock Exchange of India Limited (NSE) on June 3, 2022 and expenses incurred by the Company in connection with the IPO have been marked as recoverable from the selling shareholder. Hence, the Company was not mandatorily required to prepare and publish quarterly results up to the year ended March 31, 2021. The audit of the special purpose Financial Statements for the nine months period ended December 31, 2020 was conducted for the purpose of the Draft Offer Document. Accordingly, Figures for the quarter ended March 31, 2021 are the balancing figures between the audited figures in resepct of the financial year ended March 31, 2021 and the audited figures for the nine months ended December 31, 2020.

6. The equity shares and basic / diluted earnings per share for the comparative period (quarter and year ended March 31, 2021) has been presented to reflect the adjustments for issue of bonus shares as approved by the shareholders on September 18, 2021 in accordance with Ind AS 33 - Earnings per share.

7. In view of pandemic relating to COVID-19, the Company has considered internal and external information assessing the recoverability of receivables, inventories and other financial assets. However, the actual impact of COVID-19 on the Company's financial statements may differ from that estimated and the Company will continue to closely monitor any material changes to

8. The figures for the quarter ended March 31, 2022 as reported in these financial results, are the balancing figures between the audited figures in respect of the full financial year and the audited year to date figures upto the end of the third guarter of the

9. Previous period's / year's figures have been regrouped / reclassified wherever necessary to confirm with the current period's /

On behalf of the Board of Directors For Aether Industries Limited Ashwin Desai Managing Director DIN:00038386

Place: Surat Date: June 16, 2022

©

**FINANCIAL EXPRESS** 

### ■ RAINFALL INTENSITY TO INCREASE IN COMING DAYS

# Monsoon 25% below normal so far

Rains anticipated in Andhra, Telangana, Kerala, Karnataka, Goa, Tamil Nadu over next 5 days

SANDIP DAS New Delhi, June 16

**AFTER AN EARLY** onset at the Kerala coast and a period of sluggish progress thereafter, the southwest monsoon has moved to Gujarat, parts of Maharashtra, Telangana, Chhattisgarh, Odisha and south Madhya Pradesh, the India Meteorological Department (IMD) said on Thursday.

The Met department has forecast heavy rainfall over coastal Andhra Pradesh, Telangana, Kerala, Goa, Maharashtra, Karnataka and Tamil Nadu during the next five days.

The northern region, which is reeling under a heat wave, will get some relief with rains expected in Himachal Pradesh and Uttarakhand.

Private weather forecaster Skymet said, "The entire plains



of Northwest India will see some relief from the heat and good rains will also be seen in Uttarakhand and Punjab on Friday."

The IMD also forecast that an intense spell of rain is likely to continue over West Bengal and Sikkim during the next five days.A Met department official told FE that in the next five days, the intensity of the monsoon would increase, bringing widespread rains across several regions of the country.

During June 1-16, the cumulative average monsoon rainfallwas 51.3 mm, which was 25% less than the normal volume of 68.1 mm.

Only the east-north region has received 27% more monsoon rainfall than the normal volume so far, while cumulative deficiency in rain over the southern peninsula was reported at 31%. Northwest India and central India have rainfall deficiency of 72% and 60%, respectively.

regions and

most parts of

On May 31, the Met department said monsoon rains this yearwould be more than what it had forecast in April, at 103% of the benchmark long-period average (LPA), with an 81% chance of rainfall being either

"normal" or above. The rains will also be welldistributed spatially across the four broad

the country, the agency had said. In its forecast for June, the Met department has predicted a normal rainfall in the range of 92-108% of LPA. With the progress of the

monsoon, sowing activities for kharif crops such as paddy, pulses, oilseeds and coarse cereals have commenced. Agriculture ministry officials said despite the sluggish start to the monsoon rains' progress, the window for the completion of kharif crop sowing is till the end of July. Meanwhile, the average water level in 143 major reservoirs in the country at present is up by 5% on year, the Central Water Commission said on Thursday. The water level is also 33% higher than the average of the last 10 years.

Reservoirs currently have 51.05 billion cubic metres (BCM) of water, which is about 29% of their combined capacity.Ayear ago, 48.65 BCM water was available in these reservoirs, while the average of the last 10 years is 38.42 BCM, according to the latest CWC note.

### **FOR INDUSTRY ONLY UDYOG VIHAR PACE CITY** INFOCITY **IMT MANESAR** BAWAL **PLOT & BUILDING FOR SALE**

1000, 4000 sq. mtr, 2 Acre, 5 Acre, 10 Acre **BUILDING FOR RENT** 25 000 to 50 000 Sq.ft. 100 000 to 200 000 Sq.ft. **LEASE FOR WAREHOUSE & LAND** New Sheds - 200 000 to 500 000 Sq. ft. SAYA ESTATE

9810235126

# CBDT looks to tighten curbs on high-pitched tax assessments

**FE BUREAU** New Delhi, June 16

THE CENTRAL BOARD of Direct Taxes (CBDT) on Thursday issued stricter instructions for administrative action against officers who resort to "high-pitched tax assessments."

In 2015, the CBDT had provided for the constitution of 'local committees to deal with taxpayer grievances from high-pitched scrutiny assessment'in each principal commissionerate region.

Considering the implementation of faceless assessment regime, the CBDT has now issued a revised instruction regarding constitution

SC stays HC

Bajaj Allianz,

deposit

New Delhi, June 16

INDU BHAN

order against

orders ₹200-cr

**IN A RELIEF** to the Bajaj Allianz General Insurance Company, the Supreme Court on Thursday stayed the Bombay High Court's decision that directed it to compensate over 0.35 million farmers from

Osmanabad district of Maharashtra, subject to the private insurer depositing ₹200 crore

with its registry within six weeks. It also said that if

insurance company failed to deposit the amount, the stay

order will stand vacated auto-

Avacation Bench comprising justices JK Maheshwari

and Hima Kohli, while seeking

a response from the Union

tural min- The HC order

istry, the had come on

Maharash- a PIL seeking

claims for

agriculturists

of Osmanabad

insured

deposited by the insurance company on the next date of

han Mantri Fasal Bima Yojana

(PMFBY Scheme), to sanction

compensation/claim to as

many as 357,287 agricultur-

ists in the Osmanabad district

for post-harvest damage

caused to the soyabean crop

due to heavy rainfall in Kharif

if the amount was not paid by

the insurance company

within six weeks, then the

Maharashtra government

should pay such claim within

sented by senior counsel Vivek

Tankha, counsel Atul Babasa-

heb Dakhi, Sandeep Sudhakar

Deshmukh and others

While Bajaj was repre-

The HC had also held that

season 2020.

six weeks.

The HC had on May 6 directed Bajaj Allianz, one of the stakeholders of the Prad-

tra govern- insurance

matically.

Agricul-

ment and

others, said

that it will

decision to release the

amount so

the


hearing in August.



and functioning of these committees. "This instruction also provides for initiation of suitable administrative action against the officer concerned, in cases where assessments are found by the local committee to be highpitched or where there is non-observance of principles of natural justice,

non-application of mind or gross negligence of assessing officer/assessment unit," the CBDT said in a statement. The local committees to deal with taxpayer grievances from highpitched scrutiny assessment shall consist of 3 members of principal commissioner rank.

The other members may be selected from the pool of officers posted as principal commissioner I-T, principle CIT (Central) or Judicial or audit of the respective region. Grievances under faceless assessment regime would be received by email and the local committee would examine to ascertain whether there is a primafacie case of high-pitched assessment.



## GST Council meet on June 28-29

**THE GOODS AND Services Tax** (GST) Council will meet on June 28-29 to deliberate on the way forward after the end of the fiveyear compensation period for states on June 30, including rationalisation of tax rates in a phased manner, as a multi-year goal due to inflationary con-

"The 47th meeting of the GST Council will be held on June 28-29, 2022 (Tuesday & Wednesday) in Srinagar," finance minister Nirmala Sitharaman's office tweeted on Thursday.

While a much-awaited restructuring of the GST slabs to raise the revenue-neutral rate (RNR), from a little over 11% now to 15.5%, could start in a small way this year in areas not prone to inflation, the GST Council will likely consider enforcing a ministerial panel's recommendations on data analytics to tighten compliance and scrutiny of GST

plugging leakages. It could consider raising the GST on online gaming from 18% to 28%, to bring the skill-


returns to augment revenues by

game tax rate at par with chance games involving gambling and betting, sources said. Ahead of the Council meet-

ing, the group of ministers reviewing the GST rates will meet virtually on Friday to discuss the proposed rejig in tax slabs, even as it may seek six more months to finalise its report. Sources said the panel headed by Karnataka chief minister Basavaraj Bommai, will review the list of goods and services exempt under GST.

(Rupees in million except as stated)

**—FE BUREAU** 



Registered and Corporate Office: Plot No. 8203, Road No 8, GIDC Industrial Estate, Sachin, Surat - 394230, Gujarat, INDIA

Website: www.aether.co.in. Email: compliance@aether.co.in;

Corporate Identification Number (CIN): U24100GJ2013PLC073434

STATEMENT OF AUDITED STANDALONE FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED MARCH 31, 2022

S.	Particulars	Quarter Ended			Year ended		
No.		31.03.2022	31.12.2021	31.03.2021	31.03.2022	31.03.202	
		(Audited)	(Audited)	(Audited) (Refer Note 7)	(Audited)	(Audited	
	Income		2000000000000		-000000 0000 0000		
1	Revenue From Operations	1,475.04	1,512.77	1,157.26	5,900.47	4,498.16	
2	Other Income	2.03	23.84	7.23	69.74	39.73	
3	Total Income (1+2)	1,477.06	1,536.61	1,164.48	5,970.21	4,537.89	
	Expenses			38			
	a) Cost of material consumed	839.21	1,122.15	511.01	3,585.21	2,249.16	
	b) Changes in inventories	(107.64)	(364.53)	19.51	(704.88)	57.7	
	c) Employee benefits expenses	57.58	70.46	60.38	270.44	221.1	
	d) Finance Cost	30.86	36.43	33.46	131.21	113.1	
	e) Depreciation and amortisation expenses	40.68	41.78	26.44	154.87	110.1	
	f) Other Expenses	264.76	292.50	210.18	1,068.63	848.5	
4	Total Expenses	1,125.45	1,198.79	860.99	4,505.48	3,599.8	
5	Profit before exception items and tax (3-4)	351.62	337.81	303.49	1,464.73	938.0	
6	Exceptional items	331.02	337.01	303.43	1,404.73	330.0	
7	Profit before tax (5-6)	351.62	337.81	303.49	1,464.73	938.0	
1	D. 1 (A) (D. C.	331.02	337.01	303.49	1,404.73	930.0	
	Tax Expenses	00.04	105.50	74 70	220 72	204.0	
	Current Tax	80.61	105,50	71.78	338.73	201.0	
	Deferred Tax	10.78	(21.68)	3.07	36.72	25.8	
8	Total tax expenses	91.39	83.81	74.84	375.44	226.8	
9	Profit for the period/year (7-8)	260.23	254.00	228.65	1,089.29	711.1	
	Other comprehensive income/(expenses) Items that will not be reclassified to profit or loss	(0.08)	0.75	0.92	(1.98)	(0.86	
	Income tax relating to items that will not be reclassified to profit or loss	0.02	(0.19)	(0.23)	0.50	0.2	
10	Other comprehensive income/(expenses) for the period/year, net of tax	(0.06)	0.56	0.69	(1.48)	(0.64	
11	Total comprehensive income for the period/year (9+10)	260.17	254.56	229.34	1,087.81	710.5	
12	Profit for the period/year attributable to:						
	-Owners of the Company	260.23	254.00	228.65	1,089.29	711.1	
	-Non controlling interest				2		
	11.550 http://doi.org/10.0000	260.23	254.00	228.65	1,089.29	711.1	
13	Other comprhensive income/(expenses) for the period/year attributable to:			1000000	Melcack		
	-Owners of the Company	(0.06)	0.56	0.69	(1.48)	(0.64	
	-Non controlling interest	-	-	-	2000	12,53808	
	*	(0.06)	0.56	0.69	(1.48)	(0.64	
14	Total comprehensive income for the period/year attributable to:	6756000000		********	0000000		
	-Owners of the Company	260.17	254.56	229.34	1,087.81	710.5	
	-Non controlling interest	858		58	58		
		260.17	254.56	229.34	1,087.81	710.5	
15	Earnings per share (Face value of Rs.10/- each)			W05003550	ngrotok(RBOT)		
	-Basic	2.31	2.29	2.37	9.67	7.3	
	-Diluted	2.31	2.29	2.37	9.67	7.3	
16	Paid-up equity share capital	1,126.91	1,126.91	100.99	1,126.91	100.9	
	(face value of Rs.10/- each)	18	100		- 50		
17	Other equity excluding revaluation reserve	2,741.97	2,475.85	1,642.34	2,741.97	1,642.3	
lote:	No. of Shares (in millions)	113	111	97	113	9	

- The above audited standalone financial results have been reviewed by the Audit Committee and thereafter approved and taken on record by the Board of Directors in their respective meetings held on June 16, 2022. These audited standalone financials results of the Company are prepared in accordance with Indian Accounting Standards ("referred to as Ind AS") as prescribed under Section 133 of the Companies Act, 2013 read with Companies (Indian Accounting Standards) Rules, 2015 as amended from time to time and the provisions of the Companies Act, 2013.
- The Statutory Auditors of the Company have audited the above standalone financial results of the Company for the guarter and year ended March 31, 2022. An unqualified opinion has been issued by them thereon.
- The standalone results of the Company are available on the Company's website, www.aether.co.in and also on the website of the BSE Limited, www.bseindia.com and National Stock Exchange of India Limited, www.nseindia.com, where the shares of the Company are listed.

Details included in Other income (net) areas below.


Particulars		Quarter Ended	Year ended		
	31.03.2022 (Audited)	31.12.2021 (Audited)	31.03.2021 (Audited)	31.03.2022 (Audited)	31.03.2021 (Audited)
Interest on fixed deposits	2.49	1.68	0.67	4.64	1.00
Interest accrued on loans to employees	0.40	0.31	0.25	1.29	0.85
Interest on deposits	0.01	0.01	0.00	0.03	0.03
Others	988876754 877047876774		90.00000	8350799	VOICENCIO
Foreign exchange fluctuation	(3.13)	8.73	3.75	18.37	18.32
Duty drawback - exports	1.56	1.46	0.84	5.14	2.92
MEIS duty credit	0.10	0.36	0.85	21.65	15.42
Income from mutual funds	0.51	1.19	50000	3.22	
Income accrued from mutual funds	0.00	0.00	0.78	0.00	0.79
Profit on sale of assets	70	((20)	0.00		0.02
Interest subsidy (term loan)		10.00	-	15.00	
Misc. income	0.09	0.10	0.09	0.38	0.38
Total	2.03	23.84	7.23	69.74	39.73

- The Company was incorporated on January 23, 2013 and in May 2022, the Shareholders of the Company made an offer sale of 2,820,000 equity shares to INR 1,810.44 million. The equity shares of the Company got listed on BSE Limited (BSE) and National Stock Exchange of India Limited (NSE) on June 3, 2022 and expenses incurred by the Company in connection with the IPO have been marked as recoverable from the selling shareholder. Hence, the Company was not mandatorily required to prepare and publish quarterly results up to the year ended March 31, 2021. The audit of the special purpose Financial Statements for the nine months period ended December 31, 2020 was conducted for the purpose of the Draft Offer Document. Accordingly, Figures for the quarter ended March 31, 2021 are the balancing figures between the audited figures in resepct of the financial year ended March 31, 2021 and the audited figures for the nine months ended December 31, 2020.
- The equity shares and basic / diluted earnings per share for the comparative period (quarter and year ended March 31, 2021) has been presented to reflect the adjustments for issue of bonus shares as approved by the shareholders on September 18, 2021 in accordance with Ind AS 33 - Earnings per share.
- In view of pandemic relating to COVID-19, the Company has considered internal and external information assessing the recoverability of receivables, inventories and other financial assets. However, the actual impact of COVID-19 on the Company's financial statements may differ from that estimated and the Company will continue to closely monitor any material changes to future economic conditions.
- 8. The figures for the guarter ended March 31, 2022 as reported in these financial results, are the balancing figures between the audited figures in respect of the full financial year and the audited year to date figures upto the end of the third quarter of the
- Previous period's / year's figures have been regrouped / reclassified wherever necessary to confirm with the current period's year's classification / discloser.

On behalf of the Board of Directors For Aether Industries Limited Ashwin Desai Managing Director DIN:00038386

appeared for farmers. financialexp.epap.in





**Associate Partners** 

Mumbai





Hospitality Partner



facebook.com/IndianExpress

Place: Surat

Date : June 16, 2022

**Broadcast Partner**